

કીમિયન કોંગો હેમરેજુક ફીવર :

પશુ મારફતે મનુષ્યમાં ફેલાતો એક ઈતરડીજન્ય રોગ

કીમિયન કોંગો હેમરેજુક ફીવર એ એક વિશિષ્ટ પ્રકારની હાયોલોમાં પ્રજાતિની ઈતરડીથી મનુષ્યમાં ફેલાતો વિધાસ્યુજન્ય રોગ છે. આ રોગને દૂંકમાં કોંગો ફીવર અથવાતો ચીરીએથાએ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વમાં સૌપદ્ધતિમાં આ રોગ ઈ.સ. ૧૯૪૪ માં કીમિયા નામક પ્રદેશમાં અને ત્યારબાદ ઈ.સ. ૧૯૫૭ ના દાયકામાં કોંગો દેશમાં જોવા મળેલ હોવાથી આ રોગનું નામ કીમિયન કોંગો હેમરેજુક ફીવર રાખવામાં આવેલ છે. તેને ઈતરડી જન્ય રોગ પણ કહી શકાય છે.

રોગનો ફેલાવો :

- આ પ્રકારની ઈતરડી જંગાલી તેમજ પાલતું પશુઓ જેવાકે ગાય, બોસ, ઘેટા અને બાકરાના બાહ્ય શરીર ઉપર તેમજ ગમાણાની આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતી જોવા મળે છે.
- મનુષ્યમાં મુખ્યત્વે આ રોગનો ફેલાવો ઈતરડીના કરકવાથી થાય છે.
- તેમજ એક માણસમાંથી લીજ માણસમાં પણ થેપગ્રસ્ટ લોહી કે અન્ય રાગવના સંસર્ગથી પણ ફેલાવાની સંભાવના રહે છે.

લક્ષણો :

મુખ્યત્વે લે તાબક્કામાં આ રોગના લક્ષણો જોવા મળે છે.

અ). પ્રારંભિક તાબક્કામાં:

- તાવ આવયો
- ઝાંયુઓમાં દુખાવો
- કળતાર થયી
- શરીર જકડાઈ જવું
- ગરદન અને કમરના ભાગમાં દુખાવો
- અંખોમાં સોણ આવવા
- ફોટોફોલીયા (તડકા સામે અશક્તતા)

(બ). જથ્યારે પછીના દિવસોમાં

- અત્યંત પેટમાં દુખાવો,
- ગળામાં સોણે આવવો,
- લોહીયુક્ત ઝડા અને ઉલટી થયી,
- લીવર અને ક૊ડની ઉપર સોણે વગેરે જેવા મુખ્ય લક્ષણો આ રોગમાં જોવા મળે છે.

નિદાન :

- આ રોગના લગભગ જથ્યા જ લક્ષણો અન્ય રોગો જેવાકે ડેન્યુનું અને મલેરિયાને મળતા આવતા હોવાથી તેમજું તાત્કાલિક નિદાન અત્યંત જરૂરી છે.
- લેલોરેટરી ટેઝ જેવીકે,
- ઇંયુનો ફલુરોસેન્ટ ટેઝ,
- એલીગ્રા (એલ્જાઈમ લિન્કડ ઇંયુનોસોર્ટઅથેસે)
- આરટી-પીસીઆર પોલીમરાઈગ્રડ થેરીન રીએક્શની વડે રોગનું નિદાન શકાય છે.
- રોગીલ વિકિના શરીર ઉપર ઈતરડી ચટકવાને કારણે લાલ ચાહું જોવા મળે છે. જેના પરથી અંશાતા: આ રોગનું નિદાન કરી શકાય છે.

ઉપયોગ :

- સીલાવીરીન નામની એન્ટીવાયરલ દવા ખાસ અસરકારક છે.
- સપોટીંગ ઉપયોગ તરીકે ગલુકોગ તેમજ નોર્મલ સલાઈન દર્દની રાહત સ્વરૂપે આપી શકાય.

રોગને અટકાવવા માટેના ઉપાયો :

- આ રોગમાં મનુષ્યનો મૃત્યુદર લગભગ ૮૦%ની આસપાસ હોવાને કારણે તેને એક ગંભીર અને જીવલેણ રોગ ગણી શકાય. માટે એક સમજદાર નાગરિક તરીકે રોગને અટકાવવા માટેના તાત્કાલિક પગલા લેવા અત્યંત જરૂરી છે. જે નીચે મુજબ છે.
- પશુઓ ઉપરની ઈતરડીને દુર કરવા પશુઓ ઉપર ૧.૨૫% ડેલ્ટામેથીન કે ફુલુંમેથીન દવાનો સ્વે કરવો અથવાતો લગાડવી.

- ૫% ડેટરામેથીન દવાનો સે ઈતરડીના છુપાવવાના સ્થાનો જેવાકે કોટ, ગમાણા અને તેની આજુબાજુની દીવાલોની તિરાડો તથા બખોલો વગેરે સ્થાનોએ કરયો.
- ૭૫ મિલી કોર્મેલીન અને ૫૦ ગ્રામ પોટેશીયમ પર્મેગેનેટ પ્રતિ ૧૦૦ ચોરસ કુટ જગ્યા ના હિસાબે રેહણાણમાં ધૂમીકરણ કરતું.
- પશુ રહેણાણની જગ્યાની જમીન ઉપર બિનજાદી કચરો કે ઘાસ પાથરીને સાંચગાવવાચી ભાદ્યા પરોપજીવીઓની જુદી જુદી અવસ્થાઓનો નાશ થાય છે. સુર્યપકાશની સીધી અસરથી નાશ થાય છે.
- ઈતરડીઓ રાગીના સમય દરમિયાન કાર્યરત રહેતી હોવાથી રાગીના સમયે પશુ રહેણાણમાં લીમડાના પાનનો ધૂમાડો કરયો.
- કાચા ભોય તળિયાવાળા પશુઓના રહેણાણમાં ઈતરડીના છુપાવવાના સ્થાનો જેવાકે તિરાડો અને બખોલો પૂરો દેવી.
- પશુઓના લેસવા અર્થ-પાથરેલું લોડિંગ મટીરીયલ જેમકે પરણ, માટી, કુશકી, છાડ વિગેરે દુર કરીને આખું મીઠું તથા ચૂનો નાખીને નાખું સાર પાથરતું.
- હવાડાની આજુબાજુની જગ્યા સ્વચ્છ રાખવી તથા પશુઓના મળમૂત્રની નિકાલ અર્થીની નીકો સાફ રાખવી.
- છાપરાં અને લાકડાનો ઉપયોગ કરીને બનાવેલ પશુ રહેણાણના હિસ્સામાં ઉપયોગ કરાયેલ લાકડાની તિરાડો, બખોલો કે જ્યાં ઈતરડી તેના ઈંડા મૂકી શકે છે તેમાં દવાનો છંટકાવ કરીને આરક્ષિત કરવી જરૂરી છે.
- આવી જગ્યાઓએ ૧૫ દિવસ બાદ દવા છંટકાવની કામગીરી પુનઃ કરવી કે જેના ફળસ્વરૂપે ઈતરડીના જીવનચક નો સંપૂર્ણ નાશ થાય છે.

આમ, ઉપર દર્શાવેલ મુજબના મુદ્દાઓને અમલમાં મુકવામાં આવે તો કોણો ફીવરને વિકારાળ સ્વરૂપ ઘારણા કરતા અટકાવી શકાય અને માનવસ્વરૂપ જીવને જોખમમાં મુક્તા અટકાવી શકાય છે.



CCHF માટે જવાદાર હાથેલોમાં પ્રજ્ઞાતિની નર અને માદા ઈતરડી

કીમિયન કોર્ગો હેમરેણ્ઝ ફીવર :

પશુ મારફતે મનુષ્યમાં ફેલાતો એક ઈતરડીજન્ય રોગ




SARVRAO AGRICULTURAL UNIVERSITY



150
PEASAGE PASTURE THE PRAIRIE



ICAR



ડૉ. જે. બી. જુટાણી, પેણાનિક (પશુવિજ્ઞાન)
પ્રો. આરતી ચેન. સોની, પેણાનિક (ગૃહવિજ્ઞાન)
ડૉ. સી. ડી. પંડ્યા, વરિષ્ઠ પેણાનિક અને વડા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (ICAR)

નવસારી કૃષિ ચુલ્લિવિશ્વિટી
એગ્રીક્લ્યુર પોલીટેકનિકની સામે,
બેસકાંગી રોડ, પાનવાડી, વ્યારા, ગ્રા.તાપી
ફોન નં. (૦૨૬૨૬) ૨૨૯૮૮૮
ચુલ્લિવિશ્વિટી પ્રકાશન નંબર : ૧૦૧/૨૦૨૦-૨૧